



Date: 16th May, 2024

To. **Department of Corporate Service BSE** Limited, P. J. Tower, Dalal Street, Fort, Mumbai-400 001

Dear Sir / Madam,

**BSE SCRIP CODE: 509835** 

Sub: Compliance under Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Pursuant to Regulation 47 of the Listing Regulations, please find enclosed copies of notices given to shareholders informing them about the meeting of Board of Directors of the Company to be held on Tuesday, May 28, 2024 published in the following newspaper;

- 1. Free Press Gujarat (English) Dtd. 16/05/2024 on Pg. No.2
- 2. Lokmitra (Gujarati) Dtd. 16/05/2024 on Pg. No.2

Please take note of the same. This is for your information and record.

Thanking you, Yours faithfully,

For, Premier Synthetics Limited

Digitally signed by VISMAY VISMAY ASHOKKUMAR MAKWANA **ASHOKKUMAR** Date: 2024.05.16 13:14:59 MAKWANA +05'30'

Vismay Makwana **Company Secretary** 

Encl: as above

Regd. Off. Surana House, B/h. Klassic Chambers, Swastik X Road, Opp. Narnarayan Complex, Navrangpura, Ahmedabad-380009, Gujarat.

079-26430946, 079-26431558 E-mail: premiersynthetics@gmail.com Website: www.premiersyntheticsltd.com

Factory Add. : Plot No. 835-837, Nr. Rakanpur Chowkadi, Rakanpur, Tal. Kalol. Dist.: Gandhinagar - 382721, Gujarat. E-mail: premiersynthetics18@gmail.com

Phone / Fax : 02764-286761

# Sam Pitroda's inheritance tax comment: Is Chicago Forum back in the reckoning in Rahul's Congress?

Sam Pitroda, chairman of the Indian Overseas Congress, is once again the eye of a political storm having advocated an inheritance tax law in the country, even as a beleaguered Congress sought to distance itself from the

to distance itself from the comments saying his views do not always reflect the position of the party.

Pitroda himself issued a clarification over his statement on inheritance tax, claiming that his remarks were twisted

Sam Pitroda, chairman of le Indian Overseas Congress, once again the eye of a colitical storm having dvocated an inheritance tax win in the country, even as a eleaguered Congress sought o distance itself from the mments saying his views do to always reflect the position of the party. Pitroda himself issued a arification over his statement in inheritance tax, claiming at his remarks were twisted

## The geopolitical glory that is gold: Why yellow metal is hitting record prices



Gold. The very word has a primeval pull. With the yellow metal hitting record prices of \$2,400 per troy ounce this year, the glitter has a polish that goes way beyond the accountants' mundane matrices of supply and demand. If the today's charged demand. It's today's charged, war-crazed global geopolitics at work. Put another way, a lot of that demand for gold has to do with wars, and a global, especially Chinese, response to the hegemony of the US dollar. Readers may be surprised to know that not only is China the world's biggest gold consumer, it is also the world's biggest producer of the shiny stuff. Now as the Chinese economy has spluttered with manufacturing slowing and demand. It's today's charged

manufacturing slowing and properly doomed, money has moved—and as money does, it has found a new road that is paved with gold. Media reports say that Chinese gold jewellery consumption has increased by a staggering 10 per cent this year and their coin and gold bar purchases have risen by a breath-taking 30 per cent. The real push, however, has been geopolitically motivated. China is moving away from the dollar and for the last two years its central bank has been continuously buying gold. Beijing views gold as a bigger part of its future holdings. The dominance of such a such particularly in emerging economies, are also bulking up their gold stockpiles, seeking a safe asset in a world grappling a stockpiles, seeking a safe asset in a world grappling a side search a world in sing geopolitical tensions. China is not alone. For, a Limca Book of Records records. manufacturing slowing and property doomed, money has

gold is a shiny hedge in stormy seas.

seas.
Imagine the global financial system as a vast ocean. During calm periods, investor confidence is high, and capital flows freely. But when geopolitical storms erupt, uncertainty reigns, as currencies weaken, investors seek refuge in safe harbours. This is where gold takes centre stage. Unlike traditional assets

centre stage.
Unlike traditional assets like stocks or bonds, gold's value is independent of any single issuer or economy. It's perceived as a physical asset with intrinsic value, a life raft in the tumultuous seas of financial uncertainty.
It is for this reason that the RBI has also increased its gold holding, buying 13 tonnes of the shine in January-February 2024. A smart move that added \$3 billion to foreign reserves on account of gold appreciating. In 2023, Turkey, with its currency plummeting, bought 12 tonnes of gold and Kazakhstan likewise shored up foreign reserves by shovelling

Aczakhstan likewise shored up foreign reserves by shovelling foreign reserves by shovelling foreign reserves by shovelling which is the ultimate hedge. The ongoing conflicts in Ukraine and Israel, besides the unpredictability of Iran, have further amplified gold's allure as a safe haven. The Ukraine war, with its crippling sanctions and supply chain disruptions, has fuelled fears of inflation and a global economic Investors, anxious about the economic slowdown.
Investors, anxious about the
broader ramifications, have
sought solace in gold. Gold
prices typically rise during
periods of heightened
geopolitical risk, and these
recent events are no
exception. In the short-term
gold will continue to fullther in gold will continue to glitter in the shade of swords. In the long run, to quote Keynes, we are all dead.

### Limca Book of Records recognizes the remarkable achievements of Indian sportspersons

Ahmedabad, Within the vast landscape of human endeavor, there exists a realm of athletics, where ordinary individuals transcend the constraints of the mundane to become extraordinary champions of motion. Athletics, in its purest form, is not merely a collection of sports or a series of events, it is a or a series of events, it is a testament to the boundess potential inherent within the human form. It is the sprinter who races against the wind, the high jumper who defies gravity's pull, and the marathon runner who conquers the limits of endurance. Each athlete, a living embodiment of deflication and discribine darse. dedication and discipline, dares to challenge the impossible

and redefine the boundaries of human achievement. But beyond the world of competition and medals, competition and medals, athletics is a journey of self-discovery and self-mastery. On this World Athletics Day, Limca Book of Records proudly honors the extraordinary triumphs of athletes etched in its pages of sports history. Since its inception, the Limca Book of Records has been a beacon of human assiration Book of Records has been a beacon of human aspiration and accomplishment, capturing the essence of unparalleled dedication and grit. Within its pages lie tales of remarkable feats, showcasing the rich history of talent across diverse athletic domains. (20-4)

The role of Sam Pitroda in Rahul Gandhi's inner circle of finalising telecommunication advisors has raised many policies and computerisation eyebrows within the grand old programmes. In the recent years, Pitroda's clout has AICC's Overseas chapters, is reportedly gone up many folder seen as instrumental in because Rahul Gandhi vides the former AICC chief's im as a fatherly figure. Frequent fours abroad In. In six autholiography. the former AICC chief's frequent tours abroad. In March 2023, Pitroda was a regular fixture at Rahul's interactions at Cambridge, London and other places in the United Kingdom. A section of the Congress leaders then had felt Rahul was 'ill-advised' to travel abroad soon after his relt Kahul was Ill-advised to travel abroad soon after his impressive first round of Bharat Jodo Yatra. Instead of trying to convert the 'liberals' and Leftists and the Indian diaspora in UK, Rahul could have focused more on domestic politics, poll-bound Kamataka or in strengthenina Karnataka or in strengthening

the Opposition unity.
Pitroda, a US-based

The relationship between Odisha Chief Minister Naveen Patnaik and Prime Minister Naveen Patnaik and Prime Minister Naveen Warendra Modi can best be described as "frenemies". And now it seems the frenemies have a common purpose. Or perhaps, this cross-alise cooperation stems from pragmatism. The ruling Biju Janata Dal (BJD) in Odisha could be joining forces with the BJP ahead off the upcoming Lok Sabha elections. The signs of a unity ticket were evident in

a unity ticket were evident in

a unity ticket were evident in the public display of goodwill between the two leaders. Ostensibly, Rising Odisha' seems to be the central idea of the BJD 'forging an alliance' with the BJP. But the key reason is Naveen Patnaik's party needs funds for various projects in Odisha and the

projects in Odisha and the

In his autobiography. In his autóbíography, Dreaming Big: My Journey to Connect India, Pitroda has given a graphic account of how he met Rajiv Gandhi in 1985 when the Indian prime minister was visiting the US to invite the technocrat to work with him Pitroda realled with him. Pitroda recalled with him. Pitroda recalled telling the Indian ambassador then, "Please tell the PM that I'm going to be in Washington with my wife. We would very much like to meet him."

The ambassador was not

The ambassador was not sure, pointing that Rajiv Gandhi's schedule was solidly booked. "I understand," Pitroda remembers telling the ambassador, "Just say that Sam Pitroda would like to see

Why BJP and BJD have joined hands in Odisha

over Rs 56,000 crore in Adilabad. So, it makes perfect sense to have a good working relationship with the Centre. Patnaik is the longest-serving chief minister of Odisha and as of 2024, one of the longest-serving chief ministers of any Indian state, holding the post for over two decades. He is only the second Indian chief minister to win five consecutive terms.

But there is also a sense of disquiet in Odisha with the

of disquiet in Odisha with the dependence of Patnaik on his bureaucrat generals, many of whom are non-Odiyas. But it

would be safe to say that his trusted aide VK Pandian, who

him (Rajiv)."
Born in Anand, Gujarat, Pitroda had travelled from Chicago to Washington along with wife Anu and three friends, Prakash Desai, Rajiv Desai and Dr Divyesh Mehta. "We were being tourists and seeing some of the sights, when I heard from the ambassador that Rajiv was free for half an hour—between Caspar Weinberger, the then defence secretary, and George P. Schultz, the then secretary of state. All of us were free to come," Pitroda wrote in his memoirs

were free to come, Pirtoda wrote in his memoirs illustrating the comfort he had with Rajiv Gandhi. During the meeting, Rajiv reportedly told Pitroda's wife: "Anu, I know Sam wants to come to India. I want you to make sure the children's

of Odisha, with its 21 Lok Sabha seats and 147 Assembly seats, is not lost on either party. In the 2019 elections, the BJD and BJP secured 12 and eight parliamentary constituencies and 112 and 23 Assembly constituencies respectively.

and 112 and 23 Assembly constituencies, respectively. The main strategy is likely to be the BJP contests the majority of Lok Sabha seats, while the BJD focuses on Assembly seats.

WESTERN RAILWAY - RAJKOT DIVISION
VARIOUS ENGINEERING WORKS

WSTERN RAILUAY RAJIOT DIVISION

VARIOUS ENGINEERING WORKS
E-Tender Notice No: 04 of 2024-25 date
1005/2024 (1) E-moder No. DiM-RJT2024-25-6-40 Name of Work: Rajiot Olivieni - Corstation of Boundary Wall

Division - Corstation of Boundary Wall

Division - Corstation of Boundary Wall

More of Corstand Wall

More of Cor

know. It's essential to get them into the right school."

them into the right school."
Pitorda goes on to add, "He
(Rajiv) was speaking to Anu
in exactly the sort of language
she wanted to hear. I couldn't
help thinking what a truly
exceptional person he was what an effort he made and

what an error the made and how relatable he could be."
Throughout 1986-89, Pitroda's ties with Rajiv deepened. "He would call me at night sometimes, at ten or ten-thirty. "Sam, come." So I would go with Anu to his home and we would talk, but the and we would talk, just the

As Rajiv got into a number of political challenges including the Bofors scandal and VP Singh's exit from the party, Pitroda emerged as a anu vr aviigii s exit from the party, Pitroda emerged as a key crisis manager. By Pitroda's admission, every day, some senior Congress leaders would meet at his 44, Lodhi Estate residence. "The players included Pranab Mukherjee, Jairam Ramesh, Numan Dubey, Krishna Rao, and several others. We'd all sit down and lay out a plan for that day, responding to the newspaper headlines, making our own headlines," Pitroda would recall later.

recall late:
Media and communication
Media and communication
Sepert Rajiv Desai was also
part of the now (in)famous
Chicago Forum. Desai,
politically inactive now,
remained part of the Congress
media department for years.
In an interview, Desai had
admitted how he and Pitroda

WESTERN RAILWAY - RAJKOT DIVISION Like us on: 1 facebook.com/Weste

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

CORRIGENDUM

corrigendum to E-Tender Notice No.

cir DEE/ADIVO6/24-25) Dt. 29.04.2024 for

lolowing tender. Tender No. EL-50-1-ADI
09-2024-25 Name of Work: Gandhidham

Electrical work in connection with provision

had pushed for economic liberation in the 1980s. "As Indians in the US, Sam and I used to meet as part of the 'Chicago Forum'. India's liberalisation was always our

agenda."
Rajiv's exit as prime
minister in 1989 and
subsequent assassination in
1991 temporarily halted the
process of economic reforms.
When PV Narasimha Rao When PV Narasimha Rao became the 'accidental prime minister' and brought economist Dr Manmohan Singh as his finance minister, structural economic reforms became a reality. However, a protectionist lobby, also known as the Bombay Club, tried to block or slow down reforms. The Rao-Singh duo

ably negotiated such obstructions but Pitroda sought leave, returning back to Chicago. He made a comeback after the Congress-led UPA came to power in 2004 Prime minister. 180 UPA Game to power in 2004. Prime minister Manmohan Singh appointed him head of the National Knowledge Commission, a project meant to fast-track "social and economic development", amid strong resistance from Arjun Singh and a section of the party.

resistance from Arjun Singh and a section of the party. During the Manmohan era, Pitroda, while heading the National Knowledge Commission, had many skirmishes with Arjun Singh who was Union human resource development (HRD) minister.

TRANSPEK INDUSTRY LTD.

Registered Office: 4<sup>th</sup> Floor, Lilleria 1038, Gotri-Sevasi Road, Vadodara, Gujarat, 390021 Volice is hereby given that the certificates for the under mentioned securities of the Compa

ony person(s) who has a claim in respect of the said securities should lodge such the Company at its Registered Office within 15 days from the date of this no

| Name of<br>Holder         | Kind of<br>securities &<br>Face value | No. Of<br>Securities.                 | Certificate<br>Numbers   | Distinctive<br>Numbers.  |
|---------------------------|---------------------------------------|---------------------------------------|--|--|
| ANIL<br>NEMICHAND<br>SHAH | Equity FV<br>RS 10                    | 30<br>20<br>150<br>104<br>Total : 304 | 46848 To 46849<br>75934 To 75935<br>98803 To 98805<br>119143 To 119145 | 1178571 To 1178600<br>2150325 To 2150344<br>3799898 To 3800047<br>4904329 To 4904432 |

Vismay Makv

SMFG India Home Finance Company Ltd.

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY [(Appendix IV) Rule 8(1)]

of 2000), and is seen to see the control of the con Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Ne he said Act calling you noy use light the borrowers (names mentioned below) interest thereon within 60 days from the date of receipt of the said notice. The repeap the amount, notice is hereby given to the borrowers mentioned herein be has Taken Symbolic and Physical Possession of the property described I under sub-section (1) of Section 13 of the Act read with Fulle 3 of the Security mentioned here in above in particular and the public in general are hereby caut with the property will be subject to the change of "SMHPO" for an amount as when the property will be subject to the rules of "SMHPO" for an amount as the said of the said of

| SI.<br>No. | Name of the Borrower(s)<br>/ Guarantor(s) LAN  | Description of Secured Assets<br>(Immovable Property)  | Demand Notice<br>Date & Amount   | Date of<br>Possession                  |
|------------|--|--|--|--|
| 1.         | LAN:-<br>600207210259413<br>1. Mohmad Rafiq Bilal<br>Shaikh, S/o. Mohd Bilal<br>Shaikh<br>2. Sabina Rafiq<br>Shaikh, S/o. Mohd Bilal<br>Shaikh | All That Pieco and Parciol of Flat No. B/102 Admessuring 150 Sq.t.l. to 12/4-6 Sq.ntrs. Super Built Up Area & 97.58 Sq. mts. Built Up Area Along With Undivided Share In The Land Of Building 19 Stituate At Revenue Survey No. 266 Paiki Northern Side Admessuring 0.38 55 Hector. Are and Southern Side Admessuring 0.38 55 Hector. Are and Southern Control of the Michael Stitus (1998) 1998 (1998) 1999 (1998 | 18.12.2023 Rs. 16,24,419.65 (Rs. Sixteen Lakh Twenty Four Thousand Four Hundred Nineteen and Paise Sixty Five Only) as on 11.12.2023                       | 11.05.2024<br>(Symbolic<br>Possession) |
| 2.         | LAN:-<br>600239211095482<br>1. Salimsha Bismila<br>Shah<br>2. Mumtaj Banu<br>Salimsha Shah   | The Property Bearing as Per Passing Plan Plot No.51<br>Admassing 18,004,000 St, Berlis Loid 10,54 yard is 66 Pl<br>Symtis, 84,145,82 Sq. mits Giround Floor & First Floor & Second<br>Floor Confessional, No.49 Will 36,44 Sq. mits Unifolded Shared in<br>The Land Of Road & CO.P Iosily Admessioning 100,43 Sq. mits.<br>11 Royal Plan <sup>2</sup> : Stable 4 Revenue Sarry No. 1106, Block<br>No.150 AP Plan 712 Admessioning 196 as in: 535-55 Sq. mits, Advar<br>Plan Plan No.134 Admessioning 1015, Sq. mits of Moyel Unifolded<br>Plan Plan No.134 Admissioning 1015, Sq. mits of Moyel Unifolded<br>Of Suarta Bounded as East-Society Internal Road, West: Sub-<br>Pol No. 60, North Sub-Plan No.55 Society Internal Road, West: Sub-<br>Pol No. 60, North Sub-Plan No.55 Society Internal Road, West: Sub-<br>Pol No. 60, North Sub-Plan No.55 Society Internal Road.  | 13.02.2024<br>Rs. 38,86,541.80<br>(Rs. Thirty Eight Lakh<br>Eighty Six Thousand<br>Five Hundred Forty<br>One and Paise<br>Eighty Only) as on<br>12.02.2024 | 14.05.2024<br>(Symbolic<br>Possession) |
| 3.         | LAN:-<br>600239211212365<br>1. Pawan Kumar<br>2. Kunta Devi  | All That Piece and Parcel of Immovable Property Plot Mo. 10 of The Society Known As "Swessik Residency" Situated At Karel Bearing Block No. 16,17 22,24,25,962,731, as Print 17718.00 Square Meters of Village Arell. Tableta: Plastna, District: Sural Total Admossuring Plot Area 40,15 Square Meters Along With Undivided Propriorate Share in Cop & East: Society Road, West: Plot No.118, North: Plot No.108, South Flot No.118, No.108, | 13.02.2024<br>Rs. 10,19,714/-<br>(Rupees Ten Lakh<br>Nineteen Thousand<br>Seven Hundred<br>Fourteen Only) as on<br>08.02.2024                              | 14.05.2024<br>(Symbolic<br>Possession) |
| 4.         | LAN:-<br>600238010736745<br>1. Rambujara Bhai<br>Rajput<br>2. Rammyben Rajput  | For The Property of Plot No. 171/As Per K.JP. Block No. 121/171.  OT The Society Known As "Andinan Erions" Situated Al Johns Bearing Block No.121, of Village: John, Talikka: Palsana, District: Sural Total Admeasuring About Plot Area 40.18 Sq. mtrs. Along With Undivided Proportionate Share In Cop & Road Land Admeasuring About 225 Sq. mtrs. Bounded as East: Plot No.154, West: Internal Society Road, North: Plot No.172, South: Plot No.170   | 13.02.2024<br>Rs. 7,91,471.42<br>(Rupees Seven Lakh<br>Ninety One Thousand<br>Four Hundred<br>Seventy One and<br>Paisa Forty Two Only)<br>as on 08.02.2024 | 14.05.2024<br>(Symbolic<br>Possession) |
| 5.         | LAN:-<br>600307210318915<br>1. Rahul S. Khadekar<br>2. Yogini Khandekar,<br>3. S. G. Khandekar   | All That Piece and Parcel of Bearing All That Piece and Parcel of Non-Agricultre Piol Of Land In Mauje Manjalyur, Vadodara Lying Bening Land Bearing R.S. No. 52392, T.P. Scheme No. 19, P. No. 147 Known A.S. Sai Arcade" Third Floor, Flat No. 307, Construction Admeasuring 52.51 Sq. Mits. Le. 565.00 Sq. fts. All Registration Sub-District & District Vadodara Bounded as East: By Flat No. 308, West: By O.t.c., North: By Open Space, South: By Common Passage.  | Rs. 7,74,633.04<br>(Rs. Seven Lakh<br>Seventy Four<br>Thousand Six<br>Hundred ThirtyThree  | 14.05.2024<br>(Physical<br>Possession) |
| l          |  |  |  | Sd                                     |

Authorized Officer, SMFG INDIA HOME FINANCE COMPANY LIMITE

would be safe to say that his trusted aide VK Pandian, who recently retired from the civil services (IAS), was a key architect in bringing both parties together by holding one-on-one talks with Home Minister Amit Shah.

Other possible factors — there is a definite groundswell of support for the BIP in the urban belts of Odisha, despite the CM's popularity with women, the anti-incumbency issue can't be ignored and Patnalk's limited campaigning could cost the BID.

The strategic importance projects in Odisha and the "double engine government will help the state".
Perhaps Odisha has taken a leaf out of the Telangana playbook. Revanth Reddy, Chief Minister of the Congress party in Telangana, calls PM Modi his elder brother while seeking funds from the Centre for development projects. Modi picked the moment to unveil and kickstart projects SYMBOLIC POSSESSION NOTICE

Registered office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbal-400051

Corporate Office: ICICI HFC Tower, JB Nagar, Andheri Kurla Road, Andheri East, Mumbal-400059

Branch Office: Sta Floor, Shakil Business Centre, Above United Bank, Mehsana-Highway, Mehsana-384002

Branch Office: 4th Floor, Office No 436-443 Emerald One, Winward Buisness Park, Jetalpur Road, Vadodara, Gujarat-390020

Whereas The undersigned being the Authorized Officer of ICICI Home Finance Company Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in secretise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 50 days from the date of receipt of the said notice.

the notice within 60 days from the date of receipt of the said notice. As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in ge the undersigned has taken possession of the property described herein below in exercise of powers co him/her under Section 13(4) of the said Act read with Rule 3 of the said rules on the below-mentioned of

| Sr.<br>No. | Name of the Borrower/<br>Co-borrower/<br>Loan Account Number  | Description of property/<br>Date of Possession   | Date of Demand<br>Notice/ Amount<br>in Demand<br>Notice (Rs.) | Name<br>of<br>Branch |
|------------|---|--|---|----------------------|
| 1.         | Subrata Senapati<br>(Borrower), Sangita<br>Senapati (Co-Borrower),<br>LHMEH00001385474.   | Plot No. 50, Kuber Nagar Patan R S No. 921,<br>Opp Ptc College Paiki Patan- 384265<br>(Ref LAN No. LHMEH00001385474)./<br>Date of Possession- 13-May-24  | 21-06-2023<br>Rs.<br>00                                       | Mehasana<br>-B       |
| 2.         | Subrata Senapati<br>(Borrower), Sangita<br>Senapati (Co-Borrower),<br>LHMEH00001385475.   | Plot No. 50, Kuber Nagar Patan R S No. 921,<br>opp Ptc College Paiki Patan-384265<br>(Ref LAN No. LHMEH00001385475)./<br>Date of Possession- 13-May-24   | 21-06-2023<br>Rs.<br>6,24,894/-                               | Mehasana<br>-B       |
| 3.         | Sajidkhan Dilavarkhan<br>Pathan (Borrower),<br>Nazimabi Sajidkhan<br>Pathan (Co-Borrower),<br>Dilavarkhan Yasinkhan<br>Pathan (Co-Borrower),<br>LHMEH00001324433. | Row House No. A 7 141 1 Mira Darvaja City R<br>S No. 5556 Paiki Sheet No. 64 Challa 247<br>Bawahor Ni Dargah No. Vistar Radhanpur Di<br>Patan Mehasama City, Census No.<br>357/141/1, R S No 5556 Paiki Sheet No 64<br>Chalf Patan Gujarat 384265, (Ref LAN No.<br>LHMEH00001324433) Boundee By. North:<br>Road, South: Adj Property, East: Road, West:<br>Adj Property Date of Possession-13-May-24 | 12-09-2023<br>Rs.<br>9,28,175/-                               | Mehasana<br>-B       |
| 4.         | Dashrathbhai Rupabhai<br>Luhar (Borrower),<br>Dadamben Dashrathbhai<br>Luhar (Co-Borrower),<br>Ratnabhai Rupabhai<br>Luhar (Co-Borrower),<br>LHMEH00001503802.    | 79 Shreenath Society Dhanera Palanpur<br>Rs No. 148 150 3 Paliki 1 Dhanera Gujarat<br>385310. (Ref LAN No. LHMEH00001503802)<br>Bounded By- North: Plot No.80, South:<br>Plot No.79 Paliki Others Land, East: 7.50 Mtr<br>Road, West: Plot No.62./<br>Date of Possession: 13-May-24  | 14-11-2023<br>Rs.<br>17,78,626/-                              | Mehasana<br>-B       |
| 5.         | Dashrathbhai Rupabhai<br>Luhar (Borrower),<br>Dadamben Dashrathbhai<br>Luhar (Co-Borrower),<br>Ratnabhai Rupabhai<br>Luhar (Co-Borrower),<br>LHMEH00001503803.    | 79 Shreenath Society Dhanera Palanpur<br>Rs No 148 150 3 Paiki 1 Dhanera Gujarat<br>385310. (Ref LAN No. LHMEH00001503803)<br>Bounded By- North: Plot No.80, South:<br>Plot No.79 Paiki Others Land, East: 7.50 Mtr<br>Road, West: Plot No.62./<br>Date of Possession: 13-May-24   | 14-11-2023<br>Rs.<br>88,030/-                                 | Mehasana<br>-B       |
| 6.         | Prahalad Prahalad<br>(Borrower), Baisraj Devraj<br>Nisad (Co-Borrower),<br>LHBRD00001290994.  | 77 Na Surat Bardoli Road 258/2 and 258/1<br>Surat Gujarat-394541 (Ref. LAN No.<br>LHBRD00001290994). Bounded By- North:<br>Plot No. 76, South: Plot No.78, East: Plot No.<br>84, West: Road/Date of Possession-10-May-24   | 19-12-2023<br>Rs.<br>12,68,546/-                              | Vadodra<br>-B        |

Date : May 16, 2024 Place: Patan, Mehas

Authorized Officer ICICI Home Finance Company Limited

## તંત્રીશ્રીની કલમે

## એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન

પાકિસ્તાન તેની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં જમ્મુ-કાશ્મીરમાં રાજૌરી જીલ્લામાં નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ ડ્રોન પર દેશના સુરક્ષાદળો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, શનિવારે મોડી રાત્રે ડ્રોન થોડા સમય માટે ભારતીય સીમામાં જોવા મળ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેરી સેક્ટરમાં સરહદ પારથી ડ્રોન જોવ મળ્યા બાદ ભારતીય સેનાને ગોળી ચલાવવાની સૂચના આપવામાં આર્વ તેમણે કહ્યું કે આ વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી પરંતું કંઈપણ શંકાસ્પદ ચીજ વસ્ત મળવા પામી ન હતી. ત્યારે રાષ્ટ વિરોધી લોકો શસ્ત્રો અને ડ્રગ્સ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતું સુરક્ષા દળો તેઓની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સતર્ક છે.આ દરમિયાન શનિવાર અને રવિવાર દરમ્યાન રાત્રે પુંછ જિલ્લાના અલ્લાહપીર વિસ્તાર પાસે થોડા સમય માટે ઝબકતી લાઇટ્સ સાથે ઉડતી વસ્તુ પણ હવામાં ફરતી જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે સુરક્ષા દળો સાથે મળીને વિસ્તારની શોધખોળ કરી અને કંઈ મળ્યું નહી. અહી પંજાબના અમૃતસર જિલ્લામાં બોર્ડર સિક્યુરિટી કોર્સ એટલે કે બીએસએફ ને ચીનમાં બનેલું ડીજેઆઈ નું મેવીક ૩ ક્લાસિક ડ્રોન મળ્યું છે. સુરક્ષા જવાનોએ હવેલિયાન ગામમાં ડ્રોનને રિકવર કર્યું છે.

## અક્ષય-અજય જેવાં મોંઘા સ્ટાર્સને સફળતાની ગેરંટી માનવામાં જોખમ

અક્ષય કુમાર-ટાઈગર શ્રોકની 'બડે મિયાં છોટે મિયાં' રૂ..3પ૦ કરોડમાં બની હતી, જ્યારે અજય દેવગનની 'મૈદાન' માટે રૂ.૨પ૦ કરોડનો ખર્ચ થયો હતો. ભારતીય બોક્સઓફિસ પર આ બંને ફિલ્મો ક્લોપ રહી છે. અક્ષયની ફિલ્મને માત્ર રૂ. ૬૪ કરોડ અને અજયની ફિલ્મને રૂ. ૪૮. ૮૫ કરોડનું કલેક્શન મળ્યું હતું. ફિલ્મો માટે ઘટી રહેલા આકર્યક્ષની વચ્ચે મુંબઈમાં કેટલાક થીયેટરને કામચલાઉ બંધ રાખી રીનોવેશન હાથ ધરવામાં આવ્યું છે. ઈદ પછી રિલીઝ થેયેલી 'દો ઔર દો ખાર' અને 'લવ સેક્સ ઔર ધોખા ર' જેવી પછારહાઝ વરવા ડા ખાર ઠા ખાર જના વાર તમ્સ આર વાળા ર જ્યા લો બજેટ ફિલ્મો પણ ચાલી નથી. એકંદરે ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકમાં હિન્દી ફિલ્મોએ રૂ.૭૦૦ કરોડનું કુલ કલેક્શન મેળવ્યું હતું. રિતિક રોશન અને દીપિકા પાદુકોશ્વની ફિલ્મ ફાઈટરના રૂ.૨૧૨ કરોડનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રથમ ત્રિમાસિકમાં એક માત્ર 'ફાઈટર' જ સારી રહી છે. એક્ઝિબિટર અનિલ થાડાણીએ જણાવ્યું હતું કે, બડે મિયાં છોટે મિયાંમાં બધું ઓડિયન્સને પસંદ પડે તેવું હતું. આમ છતાં ફિલ્મ ચાલી ન હતી અને તેમાં ક્યાં ચૂક રહી તે હજુ સમજાતું નથી. ફિલ્મમાં કઈ વસ્તુ વધારે ચાલી જશે તે કહેવું અ અને તેથી સાવ અનિશ્ચિતતાનો માહોલ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી તકલીફ ગાડરિયા પ્રવાહની છે. કોઈ ફિલ્મ કે કન્સેપ્ટ હિટ જણાય તો તેના જેવી સંખ્યાબંધ ફિલ્મો બનવા માંડે છે. શાહરૂખ ખાને પોતાની ફિલ્મ જવાન અને પઠાણમાં ખૂબ ઓછું પ્રમોશન કર્યું હતું. ફિલ્મોને ચર્ચામાં રાખ્યા વગર તેને હિટ બનાવવાનો નુસખો શાહરૂખ ખાનને માફક આવ્યો હતો, જયારે અન્ય ફિલ્મમેકર્સ તેને ફોલો કરવા ગયા તો કિલ્મો ચાલી જ ન હતી. પશ્લિસિટી વગર ફિલ્મને સફળ બનાવવાનું આમ પણ અથરું છે. ફિલ્મ સ્ટાર્સ મોલમાં જીય, ઈવેન્ટ્સ કરે, ઈન્ટરવ્યૂ આપે અને ટીવી શોમાં જોવા મળે તો તેનાથી જ્ય, ઇન્ફ્રેસ ૩૧, ઇન્ટરમું આપ અંગ ડાવા સામાં જાય મેંગ તા માના ફિલ્મ અંગે ઉદ્યુક્તા ઊભી થયે છે. ફિલ્મના સ્ટ્રાર્સ ક્યાંય જોવા જ ના મળ્યાં હોય અને ફિલ્મ અંગે ચર્ચા ન થઈ હોય તો ઓડિયન્સમાં ઉત્સુકતા ઊભી કરી શકાય નહીં, તેવું એક વર્ગ માને છે. કદાચ ઓછી પબ્લિસિટીના કારણે જ આ વર્ષે 'ફાઈટર'ને બાદ કરતાં કોઈ ફિલ્મ ન ચાલી હોય તેવં બની શકે. ફિલ્મના ાઇટર 'નાયું આ કાંગ્રહ્મના કાંગ્રહ્મના કાંગ્રહ્મના કાંગ્રહ્મના મારા હરે'ના ભજેટમાં સૌથી વધુ ખર્ચ સ્ત્રસંત્તી કીનો હોય છે. રિપોર્ટ્સ મુજબ, બડે મિયાં છોટે મિયાં માટે અથય કુમારે રૂ.૮૦ કરોડ કી વસૂલી હતી, જ્યારે ટાઈગર શ્રોકને રૂ.૪૦ કરોડ મળ્યા હતા. આ હિલ્મનું હુલ બજેટ રૂ.૩૫૦ કરોડ હતું અને તેમાંથી રૂ.૧૫૦-૨૦૦ કરોડ કલાકારોની ફીમાં ખર્ચાયા હતા. કલાકારોને કરોડો રૂપિયાની ફી આપવાના બદલે ફિલ્મોની સફળતાના ફી નક્કી કરવાનો કન્સેપ્ટ પણ અમલમાં આવી રહ્યો છે. તેના કારણે ફિલ્મ મેકર્સને ખોટ કાબુમાં રાખવાની તક મળે છે.

## મનોજ બાજપેયી પોતાની ફિલ્મ 'ભૈયા જી'થી ધૂમ મચાવવા માટે તૈયાર

દેશી સુપરસ્ટાર મનોજ બાજપેયી પોતાની ફિલ્મ 'ભૈયા જી'થી ધૂમ મચાવવા માટે તૈયાર છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ મનોજની મચાવવા માટે તયારે છે. સાથી આશ્ચયજનક વાત એ છે કે આ મનાજન '૦૦ની ક્લિમ છે, જેનું ટ્રેલર ક્લિટીન થઈ ગયું છે એને તે જબરદસ્ત છે. આ ફિલ્મમાં તમે મનોજ બાજપેયીને એવા રૂપમાં જોવા જઈ રહ્યા છો કે તમે તેને પહેલા ક્યારેય જોયો નથી. ટ્રેલર, જે એક્શન, ડ્રામા અને લોહીલુહાળથી ભરેલી બદલાની વાર્તા બતાવે છે, તે તમને હંકાવી દશે. મનોજ બાજપેયી આ કેલ્સમાં ભેયા જીની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં એક પાત્ર તેના વિશે કહી રહ્યું છે. ભૈયાજી વિશે જણાવતા તે વ્યક્તિ કહે છે - 'ભાઈ, જો આપણે રાજનીતિની વાત કરીએ તો ભૈયાજી શાસક પક્ષને વિપક્ષમાં અને વિપક્ષને

# ક્રોમ્પ્ટનએ DJSI સ્કોરમાં ટોચનું રેક્રિંગ મેળવ્યુ Crompton

કન્ઝ્રયુમર પ્રોડ઼ ક્ટ્સની બહોળી શ્રેશી માટે જાણીતી છે તેથે પોતાના શ્રેષ્ઠ પર્યાવરણીય, સામાજિક અને સંભાળ (ESG) પ્રદર્શન માટે ડાઉ જોન્સ સસ્ટેનેબિલીટી ઇન્ડેક્સ (DJSI)માં ટોચનું રેકિંગ પ્રાપ્ત કર્યુ છે. ક્રોમ્પ્ટન વર્લ્ડવાઇડ, તેને વૈશ્વિકસ્તરે ૯૪માં પર્સેન્ટાઇલમાં મુકે છે અને સમોવડીયાની તુલનામાં DHP હાઉસહોલ્ડ ડ્યોરેબલ્સ ક્ષેત્રે છાં ક્યાન ધરાવે છે. આ રેટિંગ વધુમાં ક્રોમ્પ્ટનના ટકાઉ આચરણો ને ઉદ્યોગમાં તેની અગ્રણી તરીકેની સ્થિતિની સમર્પિતતા પર ભાર મુકે

અમદાવાદ, કોમ્પ્ટન શ્રીવ્સ છે. ડાઉ જોન્સ સસ્ટેનેબિલીટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડ જે ઇન્ડેક્સ (DJSI)ની સ્થાપના પોતાની ઉર્જા કાર્યક્ષમ અને ટકાઉ ૧૯૯૯માં થઇ હતી જે વિશ્વભરમાં . ડાઉ જો ન્સ સસ્ટેને બિલીટી જાહેરાતમાં ટ્રેડિંગ થતુ હોય તેવી હજારો કંપનીઓના ટકાઉતા પ્રદર્શનનું મૂલ્યાંકન કરે છે. DJSIની આકરી મૂલ્યાંકન પ્રક્રિયામાં કંપનીઓનું આર્થિક, પર્યાવરણીય અને સામાજિક શરતોને આધારે મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે, જેમાં લાંબાગાળાની ટકાઉતા પર ભાર મુકવામાં આવે છે. ઉદાહરણ તરીકે DJSI વર્લ્ડ લાંબા ગાળાની FSG શરતોને આધારે S&F બ્રોડ માર્કેટ ઇન્ડેક્સમાં રહેલી મહાકાય ૨,૫૦૦ કંપનીઓમાંથી ટોચના ૧૦% ટકા કંપનીઓને ઓળખી કાઢે છે. (૨૨-૨)

# જ્યારે ૧૯૪૭માં ધર્મના આધારે PAK બન્યું તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ ન બનાવવામાં આવ્યું?

મંડી લોકસભા સીટથી ભારતીય જનતા પાટી (મ્હું)ની ઉમેદવાર કંગના રનૌતે હિન્દુ રાષ્ટ્રને લઈને મોઢું નિવેદન આપ્યું છે. કંગના રનૌતે કુલ્લુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્ હુનું કે જયારે ૧૯૪૭માં ધર્મના આધારે પાકિસ્તાનની રચના આધાર પાકિસ્તાનની રચના કરવામાં આવી હતી, ત્યારે તે સમયે ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર કરવામાં આવ્યું ન હતું?કંગનાએ કહ્યું કે આપણા વડાપ્રધાન યુગના માણસ છે. આપણા પૂર્વજોએ મુઘલોની ગુલામી, પછી અંગ્રેજોની ગુલામી અને પછી કોંગ્રેસનું આ કુશાસન જોયું છે. પરંતુ આપણને સાચી આઝાદી ૨૦૧૪માં મળી હતી. આપણને આઝાદી મળી. વિચારવાની स्वतंत्रता. सनातननी स्वतंत्रता. સ્વાતંત્રાા, સંવાતભા સ્વાતંત્રાા, પોતાનો ધર્મ બનાવવાની સ્વતંત્રતા, આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સ્વતંત્રતા. જયારે ૧૯૪૭માં તમે સ્વાત્રતા. જ્યાર ૧૯૪૭ના તન ધર્મના આધારે પાકિસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવ્યું, તો પછી તમે ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ ન બનાવ્યું?

ઉશ્કેરાયેલા ટોળાએ માસિક વીજ બિલ

બેથી ત્રણ ગણું આવતું હોવાના આક્ષેપો કરીને સ્માર્ટ મીટર કાઢીને

જુના વીજ મીટર લગાવી દેવા ઉગ્ર માંગ કરી હતી. સ્માર્ટ મીટરમાં ગરબ

હોવાના પણ આક્ષેપો ટોળાએ કર્યા

હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી વડોદરામાં પ્રત્યેક વીજ કનેક્શન

ાસદા પડાદરાના પ્રત્યક પાજ કનકરાન ધારકનું જૂનું વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવવાની કાર્યવાહીનું કામ એજન્સીને આપવામાં આવ્યું છે. સુભાનપુરા વિસ્તારમાં વિસ્તારમાં તાજેતરના

દિવસોમાં જુના વીજ મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર એજન્સી દ્વારા

સુભાનપુરા વિસ્તારની વીજ નિગમની કચેરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્વામી વિવેકાનંદ

ગાવાસ સાઇગામાં સ્વાગા (વવકાયક હાઇટ્સ-૧ના સ્થાનિક રહીશોનું રોષે ભરાયેલું મસ મોટુ ટોળું સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ નિગમની

લગાવવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે કંગના ઘણા પ્રસંગોએ આવા રાજકીય નિવેદનો આપતી રહી છે. તેમણે નવેમ્બર ૨૦૨૧માં એમ પણ કહ્યું હતું કે 'વાસ્તવિક આઝાદી' ૧૯૪૭માં નહીં, પરંતુ ૨૦૧૪માં મળી હતી. કંગનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કાર્યકાળને સાચી સ્વતંત્રતા ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ ઘણો વિવાદ થયો હતો હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના ૨નૌતનો મુકાબલો કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ સાથે થશે. આ બેઠક પર ૧ જૂને મતદાન થશે. ચૂંટણી પ્રચાર દરમિયાન કંગના અને વિક્રમાદિત્ય અનેક પ્રસંગોએ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા રહ્યા છે. વિક્રમાદિત્ય સિંહે કંગનાનું નામ લીધા વિના બીફ ખાવા પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે હિમાચલ એ દેવી-દેવતાઓનું પવિત્ર સ્થળ છે. તે દેવભૂમિ છે. બીફનું સેવન કરનારાઓએ એહીં ચૂંટણી લડવી જોઈએ. અહીંની સંસ્કૃતિ માટે આ ચિંતાનો વિષય છે.આ પછી કંગનાએ વિશ્વમાદિત્ય પર વળતો પ્રહાર કરતા કહ્યું કે હું બીફ્ર કે કોઈપણ પ્રકારનું રેડ

સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ

મીટરોમાં ગરબડ હોવાના આક્ષેપ

સ્માર્ટ મીટર કાઢીને જુના વીજ મીટર પુનઃ લગાવી આપવા માંગ કરી હતી. સ્માર્ટ વીજ મીટર લાઈટનું બિલ

બે થી ત્રણ ગણું વધી ગયું હોવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત વીજ રિચાર્જ ખતમ થયા બાદ કનેક્શન

કાપી નાખવામાં આવે છે. આ સ્માર્ટ મીટરમાં ગરબડ હોવાના પણ એકત્ર

સ્થાનિક રહીશોના ટોળાંએ આક્ષેપ કર્યા હતા. જ્યારે બીજી બાજ વીજ નિગમની ઓફિસમાં ઉપસ્થિત કરીએ

જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર નાખવાનો

કાન્ટ્રાક્ટ ખોનગા અજન્સાન આપવામાં આવ્યો છે. આ અંગે અમે વધુ કંઈ કહી શકીએ નહીં એમ તેમણે જણાવ્યું હતું. સ્માર્ટ મીટર લગાવવા બાબતે વીજ નિગમ દ્વારા કોઈપણ જાતની આગોતરી જાણ કરવામાં

આવી નહીં હોવાના પણ આક્ષેપ

કરવામાં આવ્યા હતા. ઘરે આવતી એજન્સી દ્વારા વીજ કનેક્શન પાસેથી

રનીંગ વીજ બીલ માંગી લેવામાં આવે

ઁ ખાનગી એજન્સીને

સ્માર્ટ વીજ મીટર વીજ કનેક્શન નિગમની ઓફિસના દરવાજ ધારકોને લગાવવાની ચાલતી અંદરથી બંધ હતા ભારે હોબાળો કાર્યવાહી સંદર્ભે સુભાનપુરા વીજ મચાવ્યા બાદ દરવાજ ખોલાયા હતા. નિગમ ની ઓફિસે એકત્ર થયેલા ઉપસ્થિત રોધે ભરાયેલા ટોળાએ નવા

ઓફિસે ઘસી ગયું હતું. વીજ છે અને સ્માર્ટ મીટર લગાવવા બાબતે

આવી રહી છે તે ખુબ જ નિંદનીય આવા રહા છતા ખૂબ જા ભાજનાય છે. હું ઘણા વખીથી યોગ અને આયુર્વેદને હંમેશા સમર્થન અને £ĝ. પ્રોત્સાહન આપું છું. હવે મારી ઈમેજને ખરડાવવાની આવી યુક્તિઓની કોઈ અસર નહીં થાય. મારા લોકો જાણે છે કે હું ગૌરવપૂર્ણ હિંદુ છું. તેમને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં

## હવે ડ્રાઈવરો પ્રતિ કલાક ૪૦થી ૪૫ કિમી સ્પીડે જ બસ ચલાવશે

અમદાવાદ, અમદાવાદમાં AMTS બસથી થતાં અક્સ્માતની अज्यांमां हिवसेने हिवसे वधारो श्रोवा મળી રહ્યો છે અને જાણે AMTS બસના ચાલકો મન ફાવે તેમ રસ્તા પર બસ ચાલવે છે અને લોકોના ભોગ લઈ રહ્યા છે. ગઈકાલે સાંજે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર નજીક અક્સ્માતનો બનાવ સામે આવ્યો હતો. અક્સ્માતની હારમાળા સર્જાય હતી. AMTS બસ ચાલકે એક નહિ બે નહિ પણ ૮

જાણ કરાય છે. પરંતુ જો કોઈ વીજ બીલ આપવાનો ઇનકાર કરે તો ભવિષ્યમાં તેમને વીજ નિગમ દ્વારા

રૂપિયાદસ હજારનો દંડ થશે તેવી

ચીમકી પણ એજન્સી દ્વારા અપાતી હોવાના પણ આક્ષેપો કરાયા હતા.

એક વખત લગાવ્યા બાદ તેને ચકાસવા બાબતે પણ કોઈપણ જાતની

રીતરસમ શીખવાડવામાં આવી નથી. નિયત યુનિટ માઇનસમાં જાય ત્યાં સુધી વીજ કનેક્શન નહીં કપાતું હોવાનું જણાવીને ત્યારબાદ વીજ કનેક્શન વીજ નિગમ દ્વારા જાણ કર્યા

વિના કાપી નાખવામાં આવતું

હોવાના પણ આક્ષેપો કરવામાં

સુભાનપુરાની સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ના મકાનો પ્રધાનમંત્રી

આવાસની મિડલ ક્લાસના લોકો

માટે બનાવવામાં આવી છે અને તેમાં મધ્યમ વર્ગના લોકો જ રહે છે જેથી

તેમને સ્માર્ટ મીટર બાબતે ચકાસણી

કરવામાં પણ ભારે તકલીફ પડતી હોવાનું પણ સ્થાનિક રહીશોએ

આવ્યા હતા

જણાવ્યં હતં.

વીજ કનેક્શન અંગે સ્માર્ટ મીટર

અક્સ્માત થતા લોકોની ભીડ એકઠી થઈ હતી અને કલાકો સુધી દ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જતા અકસ્માત થયો હતો. ટ્રાફીક પોલીસે બસ ચાલકની ધરપકડ કરી બીજા દિવસે સવારે

વાહનો સાથે અક્સ્માત સર્જ્યો હતો

જામીન પર મુક્ત કર્યો હતો. આ અકસ્માતમાં અર્ટિંગા કારમાં સવાર ત્રણ લોકો અને બાઇક સવાર સહિત ત્રહાલાં અને બાઇક સંયાર સાહા ચાર લોકોને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એએમટીએસ બસથી થત મોટો નિર્ણય લીધો છે. છસ્જી બસની ઝડપ અંગે તંત્રએ મહત્ત્વનો નિર્ણય કર્યો કે હવે એએમટીએસની બસ ૪૫ કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી શકાશે નહીં.

પશ્ચિમ રેલ્વે - રાજકોટ ડિવિઝન 100 ct 100 ct

પશ્ચિમ રેલવે - અમદાવાદ ડિવિઝન

સુધારો યેના ટેન્ડર માટે ઈ -ટેન્ડર નોટિસ નંબ DEE/AD/06(24-25) તારીખ 29.04.205 કે સુધારો. ટેન્ડર નંબર : EL-50-1-AD)-T-06 24-25 કામનું નામ : ગાંધીધામ - અમદાવા વિઝનમાં ગાંધીધામ ખાતે અલગ રિમોટ કેટ્રો આ (20-1) માર્ચિક સ્ટેન્ડન નામ કેટ્સ સ્ટેન્ડન નામ કેટ્સ ટેન્ડિક આ (20-1) માર્ચિક સ્ટેન્ડન નામ કેટ્સ ટેન્ડિક ડિવિઝનમા ગાયાયાન જાત — સેન્ટર (RCC)ની જોગવાઈના સંબંધમાં ઈલ્ કામ. નોંધ લેવા માટેના ફેરફારો - ટે કરવામાં આવ્યું કારણ કે કેટલીક વસ્તુઓ સંચાલિત હતી, તેથી એસ્ટીમેટ માં સુધારો

વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જણાવાયું સ્વાભાવિક રીતે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને

ગાંધીનગર, હવામાન વિભાગ દ્વારા આગામી ૩-૪ દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, સાખરકાઠા, નપસારા, પલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

લઈને ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડતોને તકેદારીનાં પગલા લેવા જશાવાયં છે. વરસાદના સમયે યાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં ન રાખવો અને જો પાક ખુલ્લામાં હોય તો સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લો અથવા તો પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો. જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

વરસાદના સમયે પાકમાં જંતનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો.

આ ઉપરાંત એપીએમસી માં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ એપીએમસી

માં વેચાણ અર્થે આવતી પેદાશો આ ના પંચાલ અંધ આવતા પંદાસા આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, છઁસ્ઝમાં વેપારીઅને ખેડૂતમિત્રોએકાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે. આ અંગે વધજાણકારી માટે આપના विस्तारना ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર — ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરી

### પશ્ચિમ રેલ્વે - રાજકોટ ડિવિઝન

<u>વિવિધ એન્જિનિયરિંગ કાર્યો</u> ઈ-ટેન્ડર નોટિસ નં: 04 વર્ષ 2024-25 તારી જોના આવ્યાના આવ્યાના પાયાના પાયાના આવ્યાના NIT ખબેર '83,746,2431.38 મહેર માર્ચે 193,700,000(છ) એન્ડિસ્ટ માર્ચેસ અંધિ NIT ખબેર '83,746,2431.38 મહેર માર્ચેસ અંધિ આવ્યાના આવ્યા WWW.ireps.gov.in RJT10 अमले Hills St?l: **1** facebook.com/WesternRlv

### TRANSPEK INDUSTRY LTD.

Registered Office: 4<sup>th</sup> Floor, Lilleria 1038, Gotri-Sevasi Road, Vadodara, Gujarat, 39002

otice is hereby given that the certificates for the under mentioned securities as/have been lost/misplaced and the holder(s) of the said securities / Appli pplied to the Company for issue of duplicate securities

Any person(s) who has a claim in respect of the said securities should lodge such claim will the Company at its Registered Office within 15 days from the date of this notice failin which the Company will proceed to issue duplicate share certificate (s) without any furth

| Name of<br>Holder         | Kind of<br>securities &<br>Face value | No. Of<br>Securities.  | Certificate<br>Numbers   | Distinctive<br>Numbers.  |
|---------------------------|---------------------------------------|------------------------|--|--|
| ANIL<br>NEMICHAND<br>SHAH | Equity FV<br>RS 10                    | 30<br>20<br>150<br>104 | 46848 To 46849<br>75934 To 75935<br>98803 To 98805<br>119143 To 119145 | 1178571 To 1178600<br>2150325 To 2150344<br>3799898 To 3800047<br>4904329 To 4904432 |
| I                         | 1                                     | Total: 304             |  | I  |

at Surana House, Behind Klassic Chambers, Swastik X Rd, Opp, Namarayar Complex, Navragupra, Ahmedabad-380009, inter alia, to consider 8 approve the Audited Financial Results for the Quarter and Financial Year ended on 31s March, 2024 to consider divident on the Non-conventible Non-Cumulative redeemable preference shares and to bransact any other business with the permission of chairman. For further details please refer the web-link Intty, www.premiersyntheticstld.com/ & https://www.bsendia.com/stock-share price/cepremier-syntheticstld.com/ & https://www.bsendia.com/stock-share price/cepremier-syntheticstld.com/ & https://www.bsendia.com/stock-share price/cepremier-syntheticstld.com/ & https://www.bsendia.com/stock-share price/cepremier-syntheticstld.com/ & https://www.bsendia.com/stock-share price/cepremier-syntheticstld.com/s08835/.

SMFG Grihashakti

એસએમએકજી ઇન્ડિયા હોમ કાયનાન્સ કંપની લિમિટેડ.

ુ ને ૫૦૪, પમો માળ , જી-બ્લોક ઇન્સીપ્રે, બીકેસી, બીકેસી, મેઇન રોડ, બાંદ્રા , , ૫૧. રજી. ઓફિસ: મેઘ ટાવર્સ, ૩જો માળ, જુનો નં. ૩૦૭, નવો નં. ૧૯૫, પુનમ

### સ્થાવર મિલકત માટે ( પરિશિષ્ઠ -૪)ના રૂલ ૮(૧) હેઠળ કબ્જા નોટીસ

| સં. | કરજદાર/જામાવદારાનુ<br>નામ અને લેન   | આરાજાત (સ્થાવર ામલકત)<br>ની વિગત   | તારીખ-૨કમ  | તારીખ                          |
|-----|---|--|--|--------------------------------|
| ۹.  | લેનનં. ૧૦૦૨૦૭૨૧૦૨૫૯૪૧૩<br>૧. મોહમદ રિકિક બિલાલ શ્રીખ,<br>એસ/ઓ, મોહાદ બિલાલ શેખ<br>૨. શ્રભિના રિકિક શેખ, એસ/ઓ, મોહદ<br>બિલાલ શેખ | કહેર ને પી 10.2 વા તમામ ભાગો એને પાત્રાંથી, માળથી 1.3.VD ડેકે. લી.<br>અટલેક 13.VL રું હતી. મી રૂપણ વિલ્કા અને પહેલા અને 69.VL ડેકે. લી.<br>બિસ્ટ અપ એરિયા બિલિંડ ને બીની જમી નામાંના બિનવર્ત્તાયાંથી લાભ સાથે, રે વન્યુ હતી રે . રૂપ દ લી. લી. લી. સાંપાણી 0.3.CV પોક્ટર<br>અરે અને કલિલ તરેલ 0.3.CV પોક્ટર અરે હતે . મી. દર્શન પાત્રાંગ હતી.<br>એકી ના 1.7 (રોકેસ્ત અડલજ), આવ્યો હતો. ને 1.2 CV પાર્થી પડે પર્સ, મી. અને પોક્ટ ને પાસ્ટ માર્ચી પડે પર્સ, મી. અને પોક્ટ પાત્રા મુજબ લોક સાઈક પ્રાપ્યી 2.1 ૪૨ સ્કે. મી. મોરે<br>રોર્સ્ટ લિકી શું સ્ત્ર  | તારીખ: ૧૮.૧૨.૨૦૨૩<br>રૂ. ૧૬,૨૪,૪૧૯. <i>૬પા-</i><br>(રૂપિયા સોળ લાખ ચોવીસ<br>હજીર ચારસો ઓગિક્રિસ<br>અને પાંસઠ પૈસા પુરા ) જે<br>૧૧.૧૨.૨૦૨૩<br>સુધી ના છે. | ૧૧.૦૫.૨૦૨૪<br>(સાંકેતિક કબ્જો) |
| ٤.  | લેન નં. ૧૦૦૨ ઝુ૯૨૧ ૧ ૧૦૯૫૪૮૨<br>૧. સલિમશા બિસમિલા શાહ<br>૨. મુમતાજ બાનુ સલિમશા શાહ  | મિકાન બેરિક પાત્ર પાંધે લાખ વાજુ ખાતે - દેપ. ૧ મળશી ૧.૮૦૦ ૪ ૧૦૦ કે. લી. છે. મહત્વે છે. ૧૦ કે. લી. થઈ કહે. ૧૯.૭ કે. લી. મેળ ૧૪૫. ૧૩ કે. મી. માર્ગ - કહો રહે. ૧૦ કે. મી. રેલા માર્ગ કહો અને કહો માર્ગ કહો કરો. જે હતા માર્ગ કહો કરો. માર્ગ કહો કરો. ૧૫૦ કહો કરો. જે હતા માર્ગ કહો કરો. ૧૫૦ કરો. માર્ગ કહો કરો. ૧૫૦ | તારીખ: ૧૩.૦૨.૨૦૨૪<br>રૂા. ૩૮,૮૬,૫૪૧.૮૦/-<br>(રૂપિયા આંત્રગીસ લાખ<br>છયાંસી હજર પાંચસો<br>એકતાલીસ અને એસી<br>પૈસા પુરા ) જે<br>૧૨.૦૨.૨૦૨૪<br>સુધી ના છે.  | ૧૪.૦૫.૨૦૨૪<br>(સાંકિતિક કબ્જો) |
| 3.  | લેનનં. ૮૦૦૨૩૯૨૧૧૨૧૨૩૨૫<br>૧. પવન કુમાર<br>૨. કુંતા ઠેવી   | સ્થાપી વિશ્વન વ્યોટ ને 1.10ના તમામ બાગો અને પાર્વસો, સોમાયાર્ટી<br>સ્વિતિક રીવેટ તેની તરીક પ્રોલિકી, કરોડ બના નિશ્વન અવાન સ્વિત્ત<br>બ્લોક ને 1, ૧,૧૭,૨૩,૩%,૧૫,૧,૧૭,૧, કે સ્લોક્ટીશન મુજબન લા<br>બાંક ને 1 ૧, ફ્લા મળતી ૧૭૧,૮૦૦,૭%, તેમ માન કરેલી, તામ બદાવા,<br>જી કુતન ફુલ મળતી પહોર એન્ટિયા ૪૦,૧૫ રહે મી. સીમોપી અને રોમાણ<br>તિમત્ત્રે વર્ષોલા માળતી ૨૮,૦૭,૪% માળ સાથે ફિસ્માન્ય પાર્વસો<br>સોસાયાર્ટી રો., પ્રાર્થમાર્થ પાર્ટ ને 1.12, ઉત્તરમાં પ્લોટ ને 1.0૮, દલિણમાં<br>પહોર ને 1.11  | તારીખ: ૧૩.૦૨.૨૦૨૪<br>રૂા. ૧૦,૧૯,૭૧૪.૦૦/-<br>( રૂપિયા દસ લાખ<br>ઓગ્પિસ હજાર સાતસો<br>ચૌદ પુરા ) જે<br>૦૮.૦૨.૨૦૨૪<br>સુધી ના છે.                           | ૧૪.૦૫.૨૦૨૪<br>(સાંકેતિક કબ્જો) |
| 8.  | લેન નં. ૨૦૦૨૩૮૦૧૦૭૩૬૭૪૫<br>૧. રામબુજારાભાઈ રાજપુત<br>૨. રામ્મયાભેન રાજપુત   | પહોટ ને, 1.91 મિલાન માટે ફિરોપી મુજબ બહીક ને, 1.2 1/1.91)<br>ઓસાચટી અરોપાન લહીરા નામે જીવાતી, લેલવા ખાતી નિક્ત, બોરિંગ<br>બહો નં 1.2 1, ગામ જોલવા તા. પલસાવા, છે. સુરત કુલ માપણી પહોટ<br>એરિયા ૪૦.1 રહે. મી. ટોર ખેતી સોએમી મોલા 2.2 પાય ને મી. જેટલા<br>ભિનવહેંચાવેલા બાગ સાથે, સિમાબઢ : પૂર્વમાં પહોટ નં.1 પડ, પશ્ચિમમાં<br>આતંદિક સોસાયટી રોડ, ઉત્તરમાં પહોટ નં.1 93, દક્ષિણમાં પહોટ નં.1 છે.   | તારીખ: ૧૩.૦૨.૨૦૨૪<br>રૂા. ૭,૯૧,૪૭૧.૪૨/-<br>(રૂપિયા સાત લાખ એકાલું<br>હજાર ચારસો ઇકોતેર અને<br>બેતાલીસ પૈસા પુરા) જે<br>૦૮.૦૨.૨૦૨૪<br>સુધી ના છે.         | ૧૪.૦૫.૨૦૨૪<br>(સાંકેતિક કબ્જો) |
| ų.  | લેન નં. ૧૦૦૩૦૭૨૧૦૩૧૮૯૧૫<br>૧. રાહુલ એસ. ખાંડેકર<br>૨. યોગિની ખાંડેકર<br>૩. એસ.જી.ખાંડેકર  | વડોદરા ખાતે મોજે ગામ માંજલપુરમાં આવેલ દિવ ખેતીલિયાક જમીન<br>પ્લોટના તમામ ભાગો અને પાસંલી, જમીન ગેલિંગ આર.એસ. ને પ. ર .ગે. ર<br>દીપી. સીમાં ને ૧૯, એક. પી. ને ૧૪૭, સાંઈ આર્કડ માને જાલી તી, ત્રીજો<br>માળ, જહેર ને .૩૦૭, બાંધકામ ખાપણી પ.૨. પા. ર કે. મી., એટલે કે<br>પ.૧૮૦૦ એક. ટી., માંથી સમજક્ત અને જાંદબો લાંદરી સિમાબલ:<br>પૂર્વમાં ઈસ્ટર ને .૩૦૮, પશ્ચિમમાં એ.ટી. સી., ઉત્તરમાં ખુલી જયા, દક્ષિણમાં<br>કોમન પોસેજ   | તારીખ: ૧૯.૧૨.૨૦૨૩<br>રૂા. ૭,૭૪,૬૩૩.૦૪/-<br>(રૂપિયા સાત લાખ ચુમોતેર<br>હજાર છસ્સો તેંત્રીસ અને<br>ચાર પૈસા પુરા) જે<br>૧૮.૧૨.૨૦૨૩<br>અધી ના છે.           | ૧૪.૦૫.૨૦૨૪<br>(ભોતિક કબ્જો)    |

સ્થળ : સુરત, વડોદરા, ગુજરાત તારીખ : ૧૪.૦૫.૨૦૨૪

સહે અધિકૃત અધિકારી, એસએમએફજી ઇન્ડિયા હોમ ફાયનાન્સ કંપની લિમિટે ( જે પહેલા ફુલરટોન ઇન્ડિયા હોમ ફાયનાન્સકંપની લિમિટેડ તરીકે ઓળખાતી.

# સાંકેતિક કબ્જા નોટીસ

કોન્ટાક્ટ

તાથી સાચુવાઇડોશન રિકંક્ટ્રકાન કાઇનાવ્યા એકેટ એન્ડ ઇન્યાં ખેલીન્ટ એક શિક્યુરિટી ઓક ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ અને શિક્યુરિટી ઇન્ટરેસ્ટ નુંકોર્સનેન્ટ ૨૦૦૨ની કલમ ૧૩(૧૨) તેની સાથે અનુચંદ 3 સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહી નીચે સહી કરનાર આઈસીઆઈસીઓઈ હોમ ઇન્ડના કર્યા હોમિટાના સત્તાવાર અધિકારીએ નીચે જાયોલ લોકોને માંગલા નીટીસ આપી છે, આ નીટીસ આપવારી ૧૦ દિવસની અંદર અહી કાર્યકારી માર્લા માર્ગલ એક વાંચલામાં આવે છે. ૧૨૪૬૨૩૨ તેના લોક યુક્તવામાં નિષ્ણય ગયા છે, આપી કરજકારો અને સામાન્ય જનતાની જાલ માટે નીચે જ્યારેલ આઇએએ અહી જ્યાયેલી વિક્લનો આજે જાયાલેલ તારીએ છે જે કલમ ૧૩ અનુચંદ ર સાથે વચતા મળેલી સત્તાની રૂએ કાર્યલાહી કરી છે. કરજકારો અને સામાન્ય જનતાને તાથી ચેતલથી આપવામાં આવે છે કે કલાઇસીઆઈસીઆઈ હોય કાઇનાવ્ય કંપની લિમીટેડ પાસે આ મિક્કતો ટાંચમાં હોય કરજકારો અને સામાન્ય

તાએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં.

| કમ<br>નં. | કરજદાર, સહકરજદારોનું નામ/<br>લોન એકાઉન્ટ નંબર  | મિલ્કતની વિગત /<br>કબ્જાની તારીખ   | િંકમાંડ નોટીસની તારીખ /<br>ડિમાંડ નોટીસની રકમ<br>(રૂ) | શાખાનું<br>નામ |
|-----------|--|--|---|----------------|
| ٩.        | સુબ્રાતા સેનાપતિ (કરજદાર) સંગીતા<br>સેનાપતિ (સહ-કરજદાર),<br>LHMEH00001385474   | પ્લોટ નં. ૫૦, કુંબેર નગર પાટણ આરએસ નં. ૯૨૧, પીટીસી ક્રેલેજ<br>સામે પૈકી પાટણ - ૩૮૪૨૬ ૫ (રેફ લેન નં.<br>LHMEH00001385474) કબ્જાની તારીખ ૧૩-મેન્૨૪.  | ૨૧.૦૧.૨૦૨૩<br>રૂદ<br>૦૦                               | મહેસાણા<br>-બી |
| ٤.        | સુબ્રાતા સેનાપતિ (કરજદાર) સંગીતા<br>સેનાપતિ (સહ-કરજદાર),<br>LHMEH00001385475.  | પ્લોટ નં. ૫૦, કુબેર નગર પાટણ આરએસ નં. ૯૨૧, પીટીસી ક્રેલેજ<br>સામે પૈકી પાટણ - ૩૮૪૨૬૫(રેફ લેન નં.<br>LHMEH00001385475) કબ્જાની તારીખ ૧૩-મે-૨૪.  | २१.०१.२०२३<br>३१.<br>१,२४,८७४/-                       | મહેસાણા<br>-બી |
| 3.        | સાજીદખાન દિલાવરખાન પઠાન<br>(કરજદાર), નદ્રીમાબી સાજીદખાન<br>પઠાન (સહ-કરજદાર) દિલાવરખાન<br>યાસીનખાન પઠાન(સહ કરજદાર)<br>LHMEH00001324433. | રો હાઉલ ને એક ૧૪૧ માટે દરવાજ દિશી આર એમને પપપલ<br>પ્રિક્ષે શીટ નં. ૯૪ વલતા ૨૪૭ બવાલોર ની દરવાલ ને વિસ્તાર રાયેન્યુટ<br>કિ. પાછા, ખોલાળા દિશી લેનસાને ને અપાક ૧૪૧, ભારત્યેલ ને.<br>પપપલ પૈકી શીટ નં. ૯૪ વલતા પાછા ગુજરાત - ૧૪૨૨૯ માટે લે કેન<br>L.HMEH0001324433) તેની ચારે બાજુ - ઉત્તરે :- રોક,<br>દક્ષિણે: વિસ્તા જોડા પૂર્વ - દેશે, પશ્ચિમો : વિસ્તા જોડા /<br>જ્ભાની તારીય ન ગ્રેને-૨૪ | ૧૨.૦૯.૨૦૨૩<br>૩૫.<br>૯,૨૮,૧૭૫/-                       | મહેસાણા<br>-બી |
| ٧.        | દશરથભાઈ રૂપાભાઈ લુહાર<br>(કરજદાર)દાદ મળેન દશરથભાઈ<br>લુહાર( સહ કરજદાર) રત્યાભાઈ<br>રૂપાભાઈ લુહાર( સહ કરજદાર)<br>LHMEH00001503802.      | ૭૯ શ્રીનાથ સોસાયટી ધાનેરા પાલનપુર આરએસ નં. ૧૪૮ ૧૫૦ ૩ પૈકી<br>૧ ધાનેરા ગુજરાત ૩૮૫ ૩૧૦, (રેક લેન નં.<br>LHMEH0001053802)<br>તેની ચારે બાજુ - ઉત્તરે : પ્લોટ નં. ૮૦, દક્ષિણે : પ્લોટ નં. ૭૯ પૈકી અન્ય<br>જમીન, પુર્વે : ૭.૫૦ મીક્ટરે રોડ, પક્ષિણે : પ્લોટ નં. ૨૮)<br>જ્જમીના કર્યું - ૩ ચેન્ટ ૧૪,   | 98.99.2023<br>3L<br>99,92,828/-                       | મહેસાણા<br>-બી |
| ų.        | દશરથભાઈ રૂપાભાઈ લુહાર<br>(કરજદાર)દાદમબેન દશરથભાઈ<br>લુહાર( સહ કરજદાર) રત્નાભાઈ<br>રૂપાભાઈ લુહાર(સહ કરજદાર)<br>LHMEH00001503803.        | ૭૯ શ્રીનાથ સોસાયટી ધાનેરા પાલનપુર આરએસ નં ૧૪૮ ૧૫૦ રેપૈકી<br>૧ ધાનેરા ગુજરાત ૩૮૫ રા૧૦, (રેક લેવ નં.<br>LHMEH0001503803)<br>તેની ચારે બાજુ - ઉત્તરે : પ્લોટ નં. ૮૦, દક્ષિણે : પ્લોટ નં. ૭૯ પૈકી અન્ય<br>જમીન, પુર્વે : ૭,૫૦ મીટર રોડ, પક્ષિયો : પ્લોટ નં. ૨૨/<br>જમીના તેમ ન ૧૩ મે - ૨૪.   | 98.99.2023<br>3L<br>CC,030/-                          | મહેસાણા<br>-બી |
| ē.        | પ્રહલાદ પ્રહલાદ ( કરજદાર), બૈસરાજ<br>દેવરાજ નિસાદ ( સહ કરજદાર)<br>LHBRD00001290994.  | ૭૭ ના સુરત બારડોલી રોડ ૨૫૮/૨ અને ૨૫૮/૧ સુરત ગુજરાત -<br>૭૯૪૫૪૧ (રેફ લેન નં. LHBRD00001290994, તેની ચારે<br>બાજુ : ઉત્તરે ઃ પ્લોટ નં. ૭૬, દક્ષિણો : પ્લોટ નં. ૭૮, પુર્વે ઃ પ્લોટ નં. ૮૪,<br>પશ્ચિમે : રોડ/૬ઌજાની તારીખ - ૧૦-મે -૨૪  | ૧૯.૧૨.૨૦૨૩<br>ફા.<br>૧૨,૬૮,૫૪૬/-                      | વડોદરા<br>-બી  |

પર જજ્ઞાવલા કરજદાર(રા/) જામાનદાર(રા/એહા બાકા નાજ્ઞા પરત કરા જવા માટ ૩૦ દિવસના નાટાસ આપવામાં આવે છે. નહા તા કલમ ૮ અન : સિક્યરિટી ઇન્ટરેસ્ટ (ઇન્કોર્સમેન્ટ) રૂલ. ૨૦૦૨ની જોગવાઈ મજબ જામીન તરીકે મકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ વેચી

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ હોમ ફાયનાન્સ કંપની લીમીટેડ